

Seat No. : \_\_\_\_\_

## AF-125

April-2015

### T.Y. B.Com. (Annual Pattern) Elements of Business Statistics (Compulsory Paper)

Time : 3 Hours]

[Max. Marks : 70

1. (a) નીચેના શ્રેણિક ઉદાહરણ સહિત સમજાવો : 4  
(i) એકમ શ્રેણિક  
(ii) શૂન્ય શ્રેણિક
- (b) જો  $A = \begin{bmatrix} 5 & 7 \\ 2 & 3 \end{bmatrix}$  અને  $B = \begin{bmatrix} 6 & 9 \\ 0 & 4 \end{bmatrix}$  હોય તો (i)  $A + B$  (ii)  $2A - B$  (iii)  $AB$  શોધો. 6
- (c) વ્યસ્ત શ્રેણિકની મદદથી નીચેના સમીકરણો ઉકેલો : 4  
 $x + y = 8$   
 $2x + 3y = 19$   
અથવા
- (a) સમજાવો : 4  
(i) ઢાળ  
(ii) અંતઃખંડો
- (b) નીચેનાના જવાબ આપો : 6  
(i) બિંદુઓ  $(-5, -3)$  અને  $(0, 7)$  વચ્ચેનું અંતર શોધો.  
(ii) બિંદુઓ  $(1, 9)$  અને  $(2, 3)$  માંથી પસાર થતી સુરેખાનું સમીકરણ મેળવો.
- (c)  $x + y - z = 0$  અને  $2x + 3y - 5 = 0$  ના છેદનબિંદુમાંથી પસાર થતી અને  $3x - 5y + 6 = 0$  રેખાને સમાંતર હોય તેવી સુરેખાનું સમીકરણ મેળવો. 4
2. (a) સમજાવો : 4  
(i) સહસંબંધનો અર્થ  
(ii) ગુણાત્મક સંબંધ
- (b) ક્રમાંક સહસંબંધાંક શોધો : 6

|   |    |    |    |    |    |    |    |
|---|----|----|----|----|----|----|----|
| X | 50 | 48 | 11 | 13 | 32 | 40 | 33 |
| Y | 74 | 73 | 60 | 68 | 69 | 27 | 36 |

(c) યુલનો ગુણાત્મક સંબંધ શોધો : 4

$$(A) = 50, (\alpha\beta) = 40, (B) = 105, N = 160$$

**અથવા**

(a) નિયત સંબંધાંક એટલે શું ? તેના ગુણધર્મો જણાવો. 4

(b) નીચેની માહિતી પરથી નિયતસંબંધ રેખાના સમીકરણો શોધો : 6

$$n = 5, \Sigma x = 30, \Sigma y = 40, \Sigma x^2 = 220, \Sigma y^2 = 340, \Sigma xy = 266$$

(c) ગુણાત્મક સંબંધ માપવાની યુલની રીતનું વર્ણન કરો. 4

3. (a) વલણ એટલે શું ? તે માપવાની કોઈપણ એક રીતનું વર્ણન કરો. 4

(b) નીચેની સામયિક શ્રેષ્ઠી માટે પાંચ વર્ષની ચલિત સરેરાશની રીતે વલણ અને અભ્યક્તાલીન વધઘટ શોધો : 6

|         |      |      |     |     |     |     |     |       |     |     |     |
|---------|------|------|-----|-----|-----|-----|-----|-------|-----|-----|-----|
| વર્ષ    | 1993 | 1994 | '95 | '96 | '97 | '98 | '99 | '2000 | '01 | '02 | '03 |
| સૂચકાંક | 113  | 119  | 120 | 125 | 119 | 123 | 122 | 126   | 129 | 125 | 130 |

(c) નીચેની માહિતી પરથી મોસમી સૂચકાંક શોધો : 4

| વર્ષ | ત્રિમાસ        |                |                |                |
|------|----------------|----------------|----------------|----------------|
|      | Q <sub>1</sub> | Q <sub>2</sub> | Q <sub>3</sub> | Q <sub>4</sub> |
| 2008 | 110            | 113            | 115            | 116            |
| 2009 | 94             | 99             | 96             | 95             |
| 2010 | 78             | 72             | 70             | 70             |
| 2011 | 100            | 103            | 104            | 102            |

**અથવા**

(a) ધંધાકીય પૂર્વનુમાનનું મહત્વ જણાવો તેમજ તે અંગેની જુદી-જુદી રીતો જણાવો. 4

(b) શરૂઆતનું પૂર્વનુમાન 90 તેમજ  $\alpha = 0.4$  લઈ ઘાતાકીય સરલીકરણની રીતે નીચેની માહિતી માટે પૂર્વનુમાન મેળવો : 6

|       |      |      |      |      |
|-------|------|------|------|------|
| વર્ષ  | 2008 | 2009 | 2010 | 2011 |
| કિંમત | 104  | 113  | 119  | 122  |

- (c) નીચેની માહિતી પરથી ન્યૂનતમ વર્ગની રીતે સુરેખાનું અન્વાયોજન કરો અને તે પરથી 2013 ના વર્ષ માટે વેચાણનું પૂર્વનુમાન મેળવો : 4

| વર્ષ               | 2008 | 2009 | 2010 | 2011 | 2012 |
|--------------------|------|------|------|------|------|
| વેચાણ (લાખ રૂ માં) | 32   | 35   | 40   | 41   | 42   |

4. (a) અંતર્વેશન અને બહિવેશન એટલે શું ? તેની ધારણાઓ જણાવો. 4
- (b) નીચેની માહિતીને આધારે 2010ના વર્ગની વસ્તીનો અંદાજ મેળવો : 6

| વર્ષ            | 2000 | 2008 | 2011 |
|-----------------|------|------|------|
| વસ્તી (લાખ માં) | 18   | 24   | 26   |

- (c) નીચેની માહિતી પરથી સાદો પ્રજનન દર અને કુલ પ્રજનન દર શોધો : 4

| ઉંમરગાળો  | 16-20 | 21-25 | 26-30 | 31-35 | 36-40 | 41-45 | 46-50 |
|-----------|-------|-------|-------|-------|-------|-------|-------|
| પ્રજનન દર | 10    | 62    | 126   | 82    | 67    | 27    | 4     |

#### અથવા

- (a) વસ્તી વિષયક આંકડાનો અર્થ સમજાવી, તેના ઉપયોગ જણાવો. 4
- (b) નીચેની માહિતી પરથી સાદા અને પ્રમાણિત મૃત્યુદરની ગણતરી કરો અને સરખાવો. 6

| ઉંમર<br>(વર્ષમાં) | શહેર A |               | શહેર B |               |
|-------------------|--------|---------------|--------|---------------|
|                   | વસ્તી  | મૃત્યુ સંખ્યા | વસ્તી  | મૃત્યુ સંખ્યા |
| 10 થી નીચે        | 6,000  | 180           | 20,000 | 800           |
| 10 – 30           | 10,000 | 150           | 25,000 | 375           |
| 30 – 50           | 25,000 | 625           | 40,000 | 1,000         |
| 50 – 60           | 30,000 | 1,500         | 20,000 | 1,000         |
| 60 થી વધુ         | 4,000  | 240           | 15,000 | 1,050         |

- (c) નીચેની માહિતી પરથી ખૂટતી કિંમત શોધો : 4

|   |   |    |    |     |    |
|---|---|----|----|-----|----|
| X | 1 | 3  | 5  | 7   | 9  |
| Y | 8 | 15 | 24 | (?) | 68 |

5. (a) પ્રચલિત સંકેતોમાં સમાંતરશ્રેષ્ઠી અને ગુણોત્તર શ્રેષ્ઠીના  $n$ મું પદ અને  $n$  પદોના સરવાળાના સૂત્રો લખો. 4
- (b) સમાંતર શ્રેષ્ઠીમાં આવેલી ત્રણ સંખ્યાઓનો સરવાળો 33 અને તેમનો ગુણાકાર 935 છે તે સંખ્યાઓ શોધો. 4
- (c) માર્ગ્યા પ્રમાણો જવાબ આપો : 6
- (i)  $3 + 8 + 13 + 18 + \dots \dots \dots$  (12 પદનો સરવાળો)
- (ii)  $1 + 4 + 16 + 64 + \dots \dots \dots$  (10 પદનો સરવાળો)
- અથવા**
- (a) સુરેખ આયોજન એટલે શું ? તેની ધારણાઓ અને ઉપયોગ જણાવો. 6
- (b) હેતુવક્ષી વિધેય  $z = 4x + 2y$  ને નીચેના પ્રતિબંધોને આધારે મહત્તમ બનાવો : 8
- $$3x + 6y \leq 180$$
- $$3x + 2y \leq 120$$
- $$x \geq 0, y \geq 0$$
-

Seat No. : \_\_\_\_\_

## **AF-125**

**April-2015**

### **T.Y. B.Com. (Annual Pattern)** **Elements of Business Statistics** **(Compulsory Paper)**

**Time : 3 Hours]**

**[Max. Marks : 70**

1. (a) Explain the following matrix with illustration : 4  
(i) Unit Matrix  
(ii) Zero Matrix

(b) If  $A = \begin{bmatrix} 5 & 7 \\ 2 & 3 \end{bmatrix}$  and  $B = \begin{bmatrix} 6 & 9 \\ 0 & 4 \end{bmatrix}$  the find (i)  $A + B$  (ii)  $2A - B$  (iii)  $AB$  6

- (c) Solve the following equations by using inverse matrix : 4  
 $x + y = 8$   
 $2x + 3y = 19$

**OR**

- (a) Explain : 4  
(i) Slope  
(ii) Intercepts

- (b) Answer the following : 6  
(i) Find the distance between the points  $(-5, -3)$  and  $(0, 7)$ .  
(ii) Find the equation of a line passing through the points  $(1, 9)$  and  $(2, 3)$ .

- (c) Find the equation of line passing through the point of intersection of the lines  $x + y - z = 0$  and  $2x + 3y - 5 = 0$  and parallel to line  $3x - 5y + 6 = 0$ . 4

2. (a) Explain : 4  
(i) Meaning of Correlation  
(ii) Association of Attributes

- (b) Find Rank Correlation Coefficient : 6

|          |    |    |    |    |    |    |    |
|----------|----|----|----|----|----|----|----|
| <b>X</b> | 50 | 48 | 11 | 13 | 32 | 40 | 33 |
| <b>Y</b> | 74 | 73 | 60 | 68 | 69 | 27 | 36 |

(c) Find Yule's coefficient of association. 4

$$(A) = 50, (\alpha\beta) = 40, (B) = 105, N = 160$$

**OR**

(a) What is regression coefficient ? State its properties. 4

(b) Find the equation of regression lines from the following data : 6

$$n = 5, \Sigma x = 30, \Sigma y = 40, \Sigma x^2 = 220, \Sigma y^2 = 340, \Sigma xy = 266$$

(c) Discuss Yule's method of measuring association of attributes. 4

3. (a) What is trend ? Discuss any one method of finding out trend. 4

(b) Using five yearly moving averages determine trend and short-term fluctuations for the following time series : 6

| Year         | 1993 | 1994 | '95 | '96 | '97 | '98 | '99 | '2000 | '01 | '02 | '03 |
|--------------|------|------|-----|-----|-----|-----|-----|-------|-----|-----|-----|
| Index Number | 113  | 119  | 120 | 125 | 119 | 123 | 122 | 126   | 129 | 125 | 130 |

(c) Calculate seasonal indices from the following data : 4

| Year | Quarter        |                |                |                |
|------|----------------|----------------|----------------|----------------|
|      | Q <sub>1</sub> | Q <sub>2</sub> | Q <sub>3</sub> | Q <sub>4</sub> |
| 2008 | 110            | 113            | 115            | 116            |
| 2009 | 94             | 99             | 96             | 95             |
| 2010 | 78             | 72             | 70             | 70             |
| 2011 | 100            | 103            | 104            | 102            |

**OR**

(a) State the importance of Business forecasting, also state the various methods for it. 4

(b) Taking initial forecast 90 and  $\alpha = 0.4$ , obtain the forecast for the following data using Exponential Smoothing method. 6

| Year  | 2008 | 2009 | 2010 | 2011 |
|-------|------|------|------|------|
| Value | 104  | 113  | 119  | 122  |

- (c) Fit the straight line to the following data using method of least squares and forecast the selling for the year 2013 : 4

|                          |      |      |      |      |      |
|--------------------------|------|------|------|------|------|
| <b>Year</b>              | 2008 | 2009 | 2010 | 2011 | 2012 |
| <b>Sales (in lakh ₹)</b> | 32   | 35   | 40   | 41   | 42   |

4. (a) Explain the meaning of Interpolation and Extrapolation. State their assumptions. 4
- (b) Estimate the population for the year 2010 by using the following data : 6

|                            |      |      |      |
|----------------------------|------|------|------|
| <b>Year</b>                | 2000 | 2008 | 2011 |
| <b>Population in lakhs</b> | 18   | 24   | 26   |

- (c) Find GFR and TFR from the following data : 4

|                       |       |       |       |       |       |       |       |
|-----------------------|-------|-------|-------|-------|-------|-------|-------|
| <b>Age Group</b>      | 16-20 | 21-25 | 26-30 | 31-35 | 36-40 | 41-45 | 46-50 |
| <b>Fertility Rate</b> | 10    | 62    | 126   | 82    | 67    | 27    | 4     |

**OR**

- (a) Explain the meaning of demographic statistics. State its uses. 4
- (b) Calculate CDR and SDR from the information given below and compare them. 6

| <b>Age<br/>(in years)</b> | <b>City A</b>     |                      | <b>City B</b>     |                      |
|---------------------------|-------------------|----------------------|-------------------|----------------------|
|                           | <b>Population</b> | <b>No. of Deaths</b> | <b>Population</b> | <b>No. of Deaths</b> |
| Below 10                  | 6,000             | 180                  | 20,000            | 800                  |
| 10 – 30                   | 10,000            | 150                  | 25,000            | 375                  |
| 30 – 50                   | 25,000            | 625                  | 40,000            | 1,000                |
| 50 – 60                   | 30,000            | 1,500                | 20,000            | 1,000                |
| Above 60                  | 4,000             | 240                  | 15,000            | 1,050                |

- (c) Estimate the missing value for the following data : 4

|          |   |    |    |     |    |
|----------|---|----|----|-----|----|
| <b>X</b> | 1 | 3  | 5  | 7   | 9  |
| <b>Y</b> | 8 | 15 | 24 | (?) | 68 |

5. (a) In usual notations, write formula of  $n^{\text{th}}$  term and the sum of  $n$  terms of A.P. and G.P. **4**
- (b) The sum of three numbers in Arithmetic progression is 33 and their product is 935. Find the numbers. **4**
- (c) Answer as required : **6**
- (i)  $3 + 8 + 13 + 18 + \dots \dots \dots$  (sum of 12 terms)
- (ii)  $1 + 4 + 16 + 64 + \dots \dots \dots$  (sum of 10 terms)

**OR**

- (a) What is Linear Programming ? State its assumptions and uses. **6**
- (b) Maximize the objective function  $z = 4x + 2y$  under the following constraints : **8**

$$3x + 6y \leq 180$$

$$3x + 2y \leq 120$$

$$x \geq 0, y \geq 0$$

---